

મુ.અ.નં.૮૮/૨૬

તલોદ પો. સ્ટે. નં.૩૧૧૧૨૨૫૦૨૬૯૧૮૦/૨૬

અરજદાર અજય શાક્યની ભારતીય નાગરીક સુરક્ષા
સંદેશ-૨૦૨૩ ની કલમ-૪૯૭ અને ૫૦૩ ની અરજી હેઠળ હુકમ

- ૧) અરજી વંચાણે લીધી, સાંભળ્યા.
- ૨) આ કામે અરજદારે હાલની અરજી કરીને અરજ ગુજારેલ છે કે, અરજદારના બેંક નામે સ્ટેટ બેંકના ખાતા નં.૪૨૯૦૩૦૯૬૫૩૫ માંથી રૂ.૪૮,૧૭૫.૭૮/- ઉપડી ગયેલ હતા. જે બાબતે આસ્પસ્ત પ્રોજેક્ટમાં કોલ કરીને ફરીયાદ નોંધાવેલ હતી જેની તા.૨૯/૧૨/૨૫ ના રોજ ફરીયાદી નં. ૩૧૧૧૨૨૫૦૨૬૯૧૮૦ થી નોંધાયેલ. જે પૈકી સામાવાળાના ૧. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં.૧૬૧૧૦૨૦૦૦૦૧૦૬૩૪માં રૂ.૨૦૦૦/-, ૨. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં.૨૨૧૬૦૧૦૦૦૦૧૧૪૬૩માં રૂ.૨૦૦૦/-, ૩. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં.૧૬૧૧૦૨૦૦૦૦૧૦૬૩૫ માં રૂ.૨૦૭૪.૬૪/-, ૪. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં.૧૪ ૭૬૦૨૦૦૦૦૦૧૩૪૭ માં રૂ.૧૦,૦૦૦/-, ૫. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ના ખાતા નં.૨૦૩૦૭૪૨૧૬૭૧માં રૂ.૨.૦૪/-, ૬. એચ.ડી.એફ.સી. બેંક ના ખાતા નં.૫૦૨૦૦૦૫૯૦૨૯૧૪૮માં રૂ.૧૮૨૬.૦૩/-, ૭. બેંક ઓફ ઈન્ડિયા બેંક ના ખાતા નં.૨૧૦૨૧૦૧૧૦૦૦૬૩૬૦ માં રૂ.૭૧૯.૪૨/-, ૮. એક્સીસ બેંક ના ખાતા નં.૯૨૫૦૨૦૦૨૭૧૩૦૧૨૦માં રૂ.૨૦૦૦/-, ૯. ફીનો પેમેન્ટ બેંક ના ખાતા નં.૨૦૨૮૭૧૦૬૧૫૭માં રૂ.૫૦.૫૭/-, ૧૦. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતા નં.૩૭૭૮૧૧૮૪૨૧૨ રૂ.૧૫૨૦/- ગયેલા. જે અરજદારના નાણા બી.એન.એસ.એસ.ની કલમ- ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતા. જે હાલ સદર બેંકમાં જેમના તેમ પડી રહેલ છે અને પરત મળેલ નથી. અને અમો અરજદારનું ખાતુ ફીઝ થયેલ છે.

અરજદાર આ બાબતે એફ.આઈ.આર. થયેલ નથી અને અમો અરજદારને આર્થિક રીતે નુકશાન થાય તેમ છે. સદર રૂપીયાથી અમો અરજદારને ગુજરાન ચલાવવા ખુબ જ જરૂરીયાત હોય જેથી સદર નાણા બેંક ખાતુ ફીઝ થયેલ છે. તે બેંક ખાતું અનફ્રીઝ કરવા તેમજ અમો અરજદારના ખાતામાં પરત મેળવવા હાલની આ અરજી કરેલ છે. સદરહું નાણા અરજદારના છે. તે બતાવવા ફરીયાદ પ્રોજેક્ટ.નં.૩૧૧૧૨૨૫૦૨૬૯૧૮૦ ની નકલ, આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, બેંક સ્ટેટમેન્ટની નકલ રજુ કરેલ છે અને સદરહું નાણા અરજદાર અંગત ઉપયોગ સારુ જરૂર હોય તે પરત સોંપવા અરજ ગુજારેલ છે.

૩) અરજી સંદર્ભે પોલીસ અભિપ્રાય વંચાણે લેતાં,અરજદારનાઓ ના સામાવાળા શંકાસ્પદ બેંક ૧. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં. ૧૬૧૧૦૨૦૦૦૦૧૦૬૩૪માં રૂ.૨૦૦૦/-, ૨. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં.૨૨૧૬૦૧૦૦૦૦૧૧૪૬૩માં રૂ.૨૦૦૦/-, ૩. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં.૧૬૧૧૦૨૦૦૦૦૧૦૬૩૫માં રૂ.૨૦૭૪.૬૪/-, ૪. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં.૧૪ ૭૬૦૨૦૦૦૦૦૧૩૪૭ માં રૂ.૧ ૦,૦૦૦/-, ૫. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ના ખાતા નં.૨૦૩૦૭૪૨૧૬૭૧ માં રૂ.૨.૦૪/-, ૬. એચ.ડી.એફ.સી.બેંક ના ખાતા નં.૫૦૨૦૦૦૫૯૦૨૯૧ ૪૮માં રૂ.૧૮૨૬.૦૩/-, ૭. બેંક ઓફ ઈન્ડિયા બેંક ના ખાતા નં.૨૧૦૨૧ ૦૧૧૦૦૦૬૩૬૦ માં રૂ.૭૧૯.૪૨/-, ૮. એક્સીસ બેંક ના ખાતા નં .૯૨૫૦૨૦૦૨૭૧૩૦૧૨૦માં રૂ.૨૦૦૦/-, ૯. ફીનો પેમેન્ટ બેંક ના ખાતા નં .૨૦૨૮૭૧૦૬૧૫૭માં રૂ.૫૦.૫૭/-, ૧૦. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતા નં .૩૭૭૮૧૧૮૪૨૧૨ રૂ.૧૫૨૦/- અમો અરજદારના નાણા તે ફીઝ થયેલ છે. સદર બેંક ખાતા શંકાસ્પદ હોવાનું જણાઈ આવેલ છે અને સદરહું ખાતુ સીઝ કર્યા બાદ શંકાસ્પદ બેંક ખાતા ધારકને અત્રેના પો.સ્ટે.થી તા.૧૫/૫/૨૬ ના

રોજ બેંક મારફતે ઇમેલ કરી દિન-૭માં કોઈ રજુઆત હોય તો અત્રેના પો.સ્ટે. સંપર્ક કરવા જણાવેલ હોવા છતાં ખાતેદાર કે અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સિઝ કર્યા બાબત અમારા સમક્ષ કોઈ વાંધા તકરાર જણાવેલ નથી. જેથી તે રૂપિયા અરજદારશ્રીને એક્સીસ બેંક ના ખાતા નં.૯૨૫૦૧ ૦૦૦૪૦૧૩૯૭૯ IFSC CODE. નં.UTIB0004706માં પાછા આપવા તેમનો સ્પષ્ટ અભિપ્રાય છે.

જ) અરજદાર તરફે પોતાની અરજીમાં જણાવ્યા મુજબ ફીઝ કરેલ મુદ્દામાલ નાણા બાબતે તે બતાવવા ફરીયાદ પ્રોજેક્ટ નં.૩૧૧૧૨૨૫૦૨૬૯૧૮૦ની નકલ, આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, બેંક સ્ટેટમેન્ટની નકલ રજુ કરેલ છે આમ રજુ થયેલ દસ્તાવેજોના આધારે અરજદાર અરજીમાં જણાવેલ રોકડ રકમના માલિક હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવે છે.

પ) વધુમાં આ કામે પોલીસ અભિપ્રાય તેમજ તે સાથે રજુ દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા. અરજદારની અરજી ધ્યાને લેતા મુદ્દામાલ નાણા જો વધુ સમય બેંકમાં ફીઝ પડી રહે તો અરજદારને નુકશાન થાય તેમ જણાય છે અને હાલના અરજદારએ માલિક હોવાનું ફલીત થતુ હોય આ મુદ્દામાલ પરત સોંપવો યોગ્ય અને વાજબી હોવાનું માનુ છું.

આમ, આ સંજોગોમાં મુદ્દામાલ અરજદારને પરત સોંપવામાં આવે તો તે યોગ્ય અને વાજબી હોવાનું જણાઈ આવતુ હોઈ યોગ્ય શરતોને આધિન યોગ્ય રકમના જામીન અને જાત મુચરકા રજુ કર્યેથી અરજદારને મુદ્દામાલ નાણા પરત સોંપવા ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

:: હુકમ ::

૧. આથી અરજદાર અજય શાક્ય , રહે.એકજારો કંપની, વાવડી ચોકડી નજીક તલોદ,તા.તલોદ,જી.સાબરકાંઠાનાઓની મુદ્દામાલ પરત મેળવવાની અરજી મંજૂર કરવામાં આવે છે.

૨. અરજદારશ્રીનાઓના સામાવાળા શંકારપદ બેંક ૧. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં.૧૬૧૧૦૨૦૦૦૦૧૦૬૩૪માં રૂ.૨૦૦૦/-, ૨. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં.૨૨૧૬૦૧૦૦૦૦૧૧૪૬૩માં રૂ.૨૦૦૦/-, ૩. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં.૧૬૧૧૦૨૦૦૦૦૧૦૬૩૫ માં રૂ.૨૦૭૪.૬૪/-, ૪. ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાતા નં.૧૪૭૬૦૨૦૦૦૦૦૧૩૪૭ માં રૂ.૧૦,૦૦૦/-, ૫. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ના ખાતા નં.૨૦૩૦૭૪૨૧૬૭૧માં રૂ.૨.૦૪/-, ૬. એચ.ડી.એફ.સી. બેંક ના ખાતા નં.૫૦૨૦૦૦૫૯૦૨૯૧૪૮માં રૂ.૧૮૨૬.૦૩/-, ૭. બેંક ઓફ ઈન્ડિયા બેંક ના ખાતા નં.૨૧૦૨૧૦૧૧૦૦૦૬૩૬૦માં રૂ.૭૧૯.૪૨/-, ૮. એક્સીસ બેંક ના ખાતા નં.૯૨૫૦૨૦૦૨૭૧૩૦૧૨૦માં રૂ.૨૦૦૦/-, ૯. ફીનો પેમેન્ટ બેંક ના ખાતા નં.૨૦૨૮૭૧૦૬૧૫૭માં રૂ.૫૦.૫૭/-, ૧૦. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતા નં.૩૭૭૮૧૧૮૪૨૧૨ રૂ.૧૫૨૦/- ફીઝ થયેલ છે. તે ખાતુ અનફ્રીઝ કરવા તેમજ સદર ખાતામાંથી તે રૂપિયા અરજદારશ્રીને એક્સીસ બેંક ના ખાતા નં.૯૨૫૦૧૦૦૦૪૦૧૩૯૭૯ IFSC CODE. નં.UTIB0004706માં પાછા સોંપવાનો હુકમ કરવામાં આવે છે.

શરતો :-

૧) અરજીમાં ઉલ્લેખીત બેંક દ્વારા સ્થગિત કરેલ રૂ.૨૨,૧૯૩/- ની રકમ બોન્ડ અને એટલી જ રકમની એક જામીન ગીરી લઈને અરજદારને પરત કરવાનો હુકમ કરવામાં આવે છે.

- ૨) સંબંધીત પોલીસ સ્ટેશનમાં આપવાના બોન્ડ અને જામીન.
- ૩) અરજદાર પાસેથી બોન્ડ અને જામીન મેળવ્યા પછી, પોલીસ ને આથી બેંકની બધી વિગતો ,ખાતા નંબર અને ખાતાધારકના નામ સાથે રકમની વિગતો સાથે સંબંધીત બેંકને યાદી મોકલવાનો આદેશ આપવામાં આવે છે.
- ૪) જો ઉપરોક્ત કાર્યવાહી દરમ્યાન કોઈ ગેરરીતી જોવા મળે છે, તો તે અરજદારની જવાબદારી રહેશે અને અરજદારને અહીં આદેશ આપવામાં આવે છે કે મુક્ત કરાયેલ રકમ કોર્ટમાં જમા કરવામાં આવશે.
- હુકમ આજરોજ ખુલ્લી અદાલતમાં વાંચી, સંભળાવી, સહી કરી જાહેર કર્યો.

તા.૦૮/૦૬/૨૦૨૬
મુ.તલોદ.

(એચ.એચ.પટેલ)
જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફ.ક. તલોદ.
(જજ કોડ નં.જીજે૦૧૭૨૨)